

ત્વરિત જાહેરાત માટે

## બ્રેમ્પટન કાઉન્સિલ એન્ડોર્સીસ ઇકો પાર્ક સ્ટ્રેટેજી (બ્રેમ્પટન કાઉન્સિલે ઇકો પાર્ક વ્યૂહરચનાને સમર્થન આપ્યું)

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (જાન્યુઆરી 29, 2020) – આજે, બ્રેમ્પટન સીટી કાઉન્સિલે ગ્રીન સીટી (હરિયાળુ શહેર) બનાવવા અને બ્રેમ્પટન માટે ગ્રીન ફેમવર્કનું (હરિયાળા માળખાનું) અમલીકરણ કરવા બ્રેમ્પટન ઇકો પાર્ક સ્ટ્રેટેજીને સમર્થન આપીને એક નોંધપાત્ર પગલું ભર્યું.

એક ઇકો પાર્ક ટકાઉ શહેરી અને કુદરતી/હરિયાળી જગ્યાઓના આંતરિક જોડાણનું નેટવર્ક હોય છે. બ્રેમ્પટન ઇકો પાર્ક સ્ટ્રેટેજી બ્રેમ્પટન ઇકો પાર્કની રચનાની લાક્ષણિકતા દર્શાવે છે અને તેના અમલીકરણ માટે માર્ગદર્શન આપવા દૂરંદેશીપણું, લક્ષ્યો અને કાર્યવાહીઓ નિર્ધારિત કરે છે. આ વ્યૂહરચનાનો હેતુ બ્રેમ્પટનના ઇકો પાર્કનું સંરક્ષણ કરવાનો, તેને સહાયતા કરવાનો અને વિકસાવવા અજોડ સામાજિક તકો પૂરી પાડવાનો અને સામુદાયિક ભાગીદારીઓ અને સંરક્ષક બનાવવાનો છે. તે બ્રેમ્પટનની કુદરતી સંરચનાઓનું સંરક્ષણ, પુનઃપ્રાકૃતિકરણ અને વૃદ્ધિ કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે.

બ્રેમ્પટનની 2,500 હેક્ટરની નેચરલ હેરિટેજ સિસ્ટમ (NHS) માંથી મોટા ભાગની જગ્યા બ્રેમ્પટન ઇકો પાર્કનો મુખ્ય આધાર બનશે. આ પાયામાંથી, બ્રેમ્પટન ઇકો પાર્કનું વિસ્તરણ અને ઉત્ક્રાંતિ શરૂઆતમાં ઓળખી કાઢેલા હબ્સની આસપાસ ધ્યાન કેન્દ્રિત કરશે, જ્યાં ઇકો સ્પેસ સ્થાપીને યોગ્ય સ્થળો જેમ કે ઉદ્યાનો, NHS, સ્ટ્રીટસ્કેપ્સ અને યુટિલિટી કોરિડોર્સ ઇકો પાર્કને અનુરૂપ બનાવવામાં આવશે. સમય વિતવાની સાથે, આ પ્રયત્નો સમગ્ર શહેરમાં ગ્રીન પાર્કની નેટવર્કમાં અને કુદરતી સંસાધન અનામતમાં પરિણમશે.

બ્રેમ્પટન ઇકો પાર્ક સ્ટ્રેટેજી વિશે વધુ માહિતી અહીં મેળવો, [www.brampton.ca](http://www.brampton.ca)

### ઝડપી હકીકતો

- બ્રેમ્પટન શહેર હાલમાં આશરે 2,500 હેક્ટર્સ જેટલો કુદરતી વારસો (નેચરલ હેરિટેજ) જાળવે છે, જેમાંથી મોટા ભાગની જગ્યા બ્રેમ્પટન ઇકો પાર્કનો મુખ્ય આધાર છે. શહેરના હાલના ઉદ્યાનો વધારાની 1,100 હેક્ટર્સ જગ્યા આવરી લે છે, જેમાંની અમુક જગ્યા બ્રેમ્પટન ઇકો પાર્કમાં સમાવી શકાય છે.
- બ્રેમ્પટન ઇકો પાર્ક સ્ટ્રેટેજી કર્મચારીગણને સીટી પાર્ક્સ સિસ્ટમનું આગળ મૂલ્યાંકન કરવા સૂચવે છે જેથી હાલના અને ભાવિ બ્રેમ્પટન પાર્ક્સમાં ઇકો સ્પેસીસને વ્યૂહાત્મક રીતે વિસ્તારવાની યોજના ઓળખી શકાય.
- બ્રેમ્પટન ઇકો પાર્ક સમુદાયને પાણી શુદ્ધિકરણ, ઉષ્ણતામાન ઉપશમન અને સ્ટોર્મવોટર રનઓફ (વરસાદી પાણી વહી જવાનું) ઘટાડવું જેવી મહત્વની સેવાઓ પૂરી પાડવાની સંભાવના ધરાવે છે. આનાથી ન કેવળ આર્થિક બચતો થશે, પરંતુ બદલાતા વાતાવરણમાં શહેરી સ્થિતિસ્થાપકતામાં પણ વધારો થશે.
- બ્રેમ્પટન ઇકો પાર્ક સ્ટ્રેટેજી શહેરની કાર્યનીતિઓ, વ્યૂહરચનાઓ અને કાર્યક્રમોના હયાત માળખાને વિકસાવે છે જેમાં સામેલ છે, બ્રેમ્પટન 2040 પ્લાન, બ્રેમ્પટન ગ્રો ગ્રીન એન્વાયરમેન્ટલ માસ્ટર પ્લાન, પાર્ક્સ એન્ડ રિક્રિએશન માસ્ટર પ્લાન, કુદરતી વારસો સંબંધિત પર્યાવરણલક્ષી સંચાલન વ્યૂહરચના, શહેરી જંગલ સંચાલન યોજના અને બ્રેમ્પટનમાં લાખો વૃક્ષોનો કાર્યક્રમ.

**ક્વોટ્સ (અવતરણો)**

“કાઉન્સિલ એક ગ્રીન સીટી બનાવવાનું ચાલુ રાખવા કટિબદ્ધ છે, અને બ્રેમ્પટન ઈકો પાર્ક સ્ટ્રેટેજી આપણાં કાયમી પ્રવાસમાં અન્ય એક સીમાચિહ્ન ચિહ્નિત કરે છે. હું વિસ્તૃત, એકબીજા સાથે જોડાયેલું બ્રેમ્પટન ઈકો પાર્ક આપણાં શહેરને પૂરા પાડે તેવા ઘણાં સામાજિક અને પર્યાવરણલક્ષી લાભો મેળવવા આશાવાદી છું.

- મેયર પેટ્રિક બ્રાઉન (Patrick Brown), સીટી ઓફ બ્રેમ્પટન

“ગયા વર્ષે, બ્રેમ્પટન વાતાવરણમાં કટોકટીની ઘોષણા કરવામાં 35 અન્ય સમુદાયો સાથે જોડાયું. આપણું લક્ષ્ય વર્ષ 2050 સુધીમાં બ્રેમ્પટનમાં ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં 80% જેટલો ઘટાડો લાવવાનું છે, અને બ્રેમ્પટન ઈકો પાર્ક સ્ટ્રેટેજીને સમર્થન આપવું એ તે લક્ષ્ય તરફ વળવાનું અન્ય એક પગલું છે. આ બ્રેમ્પટનની હરિયાળી જગ્યાઓનું સંરક્ષણ, સહાયતા કરવા અને તેને વિકસાવવા સામુદાયિક ભાગીદારીઓ અને સંરક્ષક બનાવવા માટે એક ચડિયાતી પહેલ છે.”

- પૉલ વિસેંટ (Paul Vicente), પ્રાદેશિક કાઉન્સિલર અને અધ્યક્ષ, પબ્લિક વર્ક્સ એન્ડ એન્જનીયરિંગ, સીટી ઓફ બ્રેમ્પટન

“મંજૂર ઈકો પાર્ક સ્ટ્રેટેજી સીટી કર્મચારીઓને ગ્રીન સીટી બનાવવાની કાઉન્સિલની અગ્રતા આગળ વધારવાનું ચાલુ રાખવા દેશે, એકબીજા સાથે જોડાયેલા ઉદ્યાનોનું નેટવર્ક બનાવવા બ્રેમ્પટનની શહેરી અને કુદરતી જગ્યાઓને વિસ્તારશે જે આપણાં શહેરની કુદરતી સંરચનાઓનું સંરક્ષણ, પુનઃપ્રાકૃતિકરણ અને વૃદ્ધિ કરશે.”

- ડેવિડ બાર્રિક (David Barrick), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સીટી ઓફ બ્રેમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તેમાં 70,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. અહીં વધુ જાણકારી મેળવો [www.brampton.ca](http://www.brampton.ca).

**મિડિયા સંપર્ક :**

મોનિકા ડુગ્ગલ

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | [Monika.Duggal@brampton.ca](mailto:Monika.Duggal@brampton.ca)